

**B.A. Semester - 1 (CBCS) Examination
Oct/Nov. -2018 (New Course)**

P1 ELEMENTARY ECONOMICS -1(CORE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧	અર્થશાસ્ત્ર એટલે શું? અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૧	ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ સમજાવી તેનાં અપવાદોની ચર્ચા કરો.	
પ્રશ્ન-૨	લાયોનલ રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા ટીકાત્મક રીતે સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૨	“માંગ અને પુરવઠો સંયુક્ત રીતે કિંમત નક્કી કરે છે” આકૃતિ સાથે સમજાવો.	
પ્રશ્ન-૩	માંગની મુલ્ય સાપેક્ષતા એટલે શું? તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૩	નીચેનાં ખ્યાલો સમજાવો. (કોઇપણ ત્રણ)	
	(૧) સંમતિનાં પ્રકારો	
	(૨) વસ્તુઓ અને સેવાઓ	
	(૩) માંગ અને પરવઠો	
	(૪) ઉત્પાદન.	
પ્રશ્ન-૪	નીચેનાં ઉત્પાદન સાધનોનાં લક્ષણોની ચર્ચા કરો.	(૧૪)
	(૧) શ્રમ (૨) નિયોજક	
	અથવા	
પ્રશ્ન-૪	નીચેનાં તફાવત સમજાવો. (કોઇપણ ત્રણ)	
	(૧) એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર.	
	(૨) આર્થિક પ્રવૃત્તિ અને બિન-આર્થિક પ્રવૃત્તિ.	
	(૩) માંગની મૂલ્ય સાપેક્ષતા અને માંગની આવક સાપેક્ષતા.	
	(૪) સીમાંત તુષ્ટિગુણ અને કુલ તુષ્ટિગુણ.	
પ્રશ્ન-૫	ટૂંકનોંધ લખો. (કોઇપણ બે)	(૧૪)
	(૧) અર્થશાસ્ત્રનાં અભ્યાસનું મહત્વ.	
	(૨) માંગ-પુરવઠાનો નિયમ.	
	(૩) તુષ્ટિગુણનાં પ્રકારો.	
	(૪) એડમ સ્મિથ અને આલ્ફ્રેડ માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા.	

ENGLISH VERSION

Que-1 What is Economics? Explain the Nature and field of Economics. (14)

OR

Que-1 Explain the law of Diminishing marginal utility and Discuss it's exceptions.

Que-2 Critically explain the definition of Economics given by Lionel Robins. (14)

OR

Que-2 "Demand and Supply jointly determine the price". Explain with a diagram.

Que-3 What is Elasticity of Demand? State it's types with the help of diagram. (14)

OR

Que-3 Explain the following concepts (any three)

- (1) Types of wealth
- (2) Goods and Services.
- (3) Demand and Supply
- (4) Production.

Que-4 Discuss the following characteristics of production Resources. (14)

- (1) Labour (2) Entrepreneur

OR

Que-4 Distinguish the following. (any three)

- (1) Micro Economics and Macro Economics.
- (2) Economic activity and non-Economic activity.
- (3) Price Elasticity of Demand and Income Elasticity of Demand.
- (4) Marginal utility and Total utility.

Que-5 Write short note. (any two) (14)

- (1) Significance of Economics Study.
- (2) Law of Demand and Supply.
- (3) Types of Utility.
- (4) Definition of Economics given by Adam Smith and Alfred Marshall.
